

ગુજરાત વિદ્યાપીઠ અંથાલથ

[ગુજરાતી કોફીરાઇટ વિભાગ]

અનુક્રમાંક ૨૧૩૮
અનુક્રમાંક

વર્ણાક

પુસ્તકનું નામ : એચ-એસ-ઓફિચિયલ

વિષય દર્શક : ૩૩

શ્રીમહેવદ્વાલાચાર્યજી, એમનુ જીવનચરિત્ર, તત્ત્વજ્ઞાન, અને ઉપદેશ વગેરે.

(કુલકંતામાં આર્થાવર્તના સંકલ ધર્માની પરિષદ દરખાં
ગાના મહારાજ સાહેબના પ્રમુખપણું નીચે તા. ૬-૧૦-૧૧
અપ્રેલ ૧૯૦૮ ના રોજ મળી હતી, તે પરિષદમાં શ્રી વદ્વાલાચ-
રિત્ર વગેરેના કર્ત્તા લદ્વાલાએ પ્રાણુવદ્વાલાસ પારેખ તરફથી
તા. ૧૧-૪-૦૮ ના રોજ વંચાયેલા ઈંગ્રેઝ નિખંધનું લાખાન્તર.)



પ્રમુખ સાહેબ અને પ્રતિનિધિ બંધુઓ,

હુ આપના આગળ શ્રીમહેવદ્વાલાચાર્યજીનું જીવન વૃત્તા-
ન્ત, એમના તત્ત્વજ્ઞાન અને ઉપદેશ સંખંધી કેટલીક છુટક
હકીકત મુકવાની રજ લેઉછું.

શ્રીમહેવદ્વાલાચાર્યજી આર્થાવર્તના એક મોટામાં મોટા ત-
ત્વવેત્તા હતા. બંગાળ અને તેની આસપાસના મુલકના લોકો
જે શ્રીમહ જૈરંગ (કૃષ્ણ ચૈતન્ય) ને હજુ સુધી પૂજે છે, તે
જે વખતે લક્ષ્મિ સંખંધી બોધ આપતા હતા, તેજ અરસામાં
શ્રીમહેવદ્વાલાચાર્યજી પણ શુદ્ધાદૈત સિદ્ધાન્ત અને લક્ષ્મિ સંખંધી
ઉપદેશ આપતા હતા. શ્રીમહેવદ્વાલાચાર્યજી શુદ્ધાદૈત ભત અ-
થવા અહ્નવાદનું પ્રતિપાદન કરનાર અને પુષ્ટ અથવા નિર્ગુણ
લક્ષ્મિ માર્ગ પ્રવર્તાવનાર માહાત્મા હતા.

આ વિષયના ગણ કરવામાં આવે છે. પેહેલા લાગમાં
શ્રીમહેવદ્વાલાચાર્યજીનું સંક્ષેપમાં જીવન વૃત્તાન્ત છે. બીજમાં
એમણે જે તત્ત્વ વિદ્યાનો અને નિર્ગુણ લક્ષ્મિનો બોધ કર્યો
તેની રૂપરેખાઓનો ઉદ્દેખ છે, અને ત્રીજમાં આવિષ્ય સંખંધી
કેટલીક ટીકાઓનો નોધ છે.

પેહેલો ભાગ.

શ્રીમહુ વદ્વલભાચાર્યજીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાન્ત.

મધ્યપ્રાંતમાં રાયપુર જલ્દિના રાજમગામની પાસે ચંપા-
રણ્યમાં શ્રીમહુવદ્વલભાચાર્યને જન્મ ઉત્તમ આદ્ધારુ જાતિમાં
વિક્રમાર્ક સંવત ૧૫૩૫ ઈ. સ. ૧૪૭૬ માંથેઓ હતો. ઘણી નાની
ઉંમરમાં વેદ, ઉપનિષદ, સમૃતિએ, પુરાણો, ધતિહાસ, દર્શાન,
અને ખીજ ઉપયોગી અંથેનો એમણે અભ્યાસ કર્યો. પોતાના
અભ્યાસકુમરમાં આ મેધાવી (બુદ્ધિશાળી) અભ્યાસીની તીવ્ર
પરીક્ષાક બુદ્ધિએ શ્રી શાંકરાદિ પ્રતિપાદિત વાદના શુણુ હોયતું
બહુ ખારીકીથી અને ચોકસાઈથી નિરીક્ષાયુ કરી લીધું. પોતે
શુરૂને ત્યાં અભ્યાસ કરતા હતા. ત્યારે શ્રી શાંકરાચાર્યના માયા-
વાદના હોય પોતાની સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થીએને એમણે
ખતાવી આપ્યા. તે વખતે ઘણાખરા બુદ્ધિશાળી લોકોના મન
ઉપર હુલાની માઝુક શ્રી શાંકરાચાર્યજીના માયાવાદનો કાણુ હતો.
શ્રીમહુચાર્યજીએ પ્રહ્લાદુત્તોના ઉપર થયેલાં તમામ ભાષ્યોનો લક્ષ
પૂર્વક અભ્યાસ કર્યો, તેથી એમને જણાયું કે શ્રી શાંકરાચા-
ર્યજીનો માયાવાદ એકદેા નહિ, પરંતુ શ્રી રામાનુજાચાર્યનો વિ-
શિષ્ટાદૈતવાદ તેમજ શ્રીમદ્ભાચાર્યજીનો દૈતવાદપણુ સર્વાશે પ્રહ્લ
સૂત્રાનુસાર ટકી શકે એવા નથી, અને પ્રહ્લ સૂત્રોનો વાસ્તવિક
અર્થ ખતાવે એવાં લાણ્ય હજુ સુધી થયાં નથી. અભ્યાસી
અવસ્થાના સમયથીજ થતા વિવાદોમાં એમણે સ્પષ્ટ રીતે ખતા-
યું કે પ્રહ્લસૂત્ર, ઉપનિષદ અને ગીતાને અનુસરે એવો વાદ
તો માત્ર પ્રહ્લવાદ છે, અને તે વાદ માયાવાદ અને ખીજ વા-
દોથી જુદો પડે છે. જમારે જયારે પોતાને પ્રસંગ મળતો લારે
ત્યારે શ્રીવદ્વલભાચાર્યજી પોતાના વિચારો પુખ્ય વિદ્ધાનોના આગળ
બાળપણુથીજ મુકૃતા.

અગીઆર વર્ષની ઉમરે શ્રીમહવલભાચાર્યજીએ પોતાનો અભ્યાસ પુરો કર્યો. આ વર્ષમાં એમના પિતા લક્ષ્મણુભક્તજી, જે પોતે એક મોટા વિદ્ધાન હતા, તેમણે આ ક્ષણુભંગુર હેઠળો ત્યાગ કર્યો. પછી શ્રી વલભાચાર્યજીએ કાર્શીનગર, જે તે વખતે વિદ્ધાન કેન્દ્ર ૩૫, અને માયાવાદના કિલ્લારૂપ હતું, તેમાં પોતાના અભ્યાસ હેઠળો છુટથી ઉપરેશ કરવા માંડયો. પોતાના પિતાનું ઉત્તર કાર્ય થઈ રહેતા સુધી એ પ્રમાણે બોધ કર્યા બાદ, એમણે આર્થિકર્તાના વિદ્ધાનોના આગળ પોતાનો અભ્યાસ મુકવાનો અને દુનિયાને ખુલ્લી રીતે એ વાદનો બોધ આપવાનો નિશ્ચય કર્યો.

પછી એ કાર્શી છોડીને ૦૪ંકૃતગિરિ ગયા. જે ગો-વિંદાના નામથી એળખાય છે તે લક્ષ્મણુભાદાજીના હર્ષાન કરી થોડા દિવસ ત્યાં રહ્યા. આ સ્થળના મંહિરની પુસ્તકશાળા એમણે તપાસી, અને અક્ષિત શાસ્ત્રોનો બારીકીથી અભ્યાસ કર્યો. આ સ્થળમાં એમણે સંલઘયું કે તુંગભદ્રા નઢી ઉપર આવેલા વિદ્ધાનગરના બળવાન રાજ્યનો તે વખતે વહીવટ કરતાર કૃષ્ણાદેવ રાજાએ ધર્મ સંભંધી એક મહત્વાની ભર્તી છે. કૃષ્ણાદેવ રાજ પોતે એક મોટો વિદ્ધાન અને કવિ હતો. શ્રી શાકરાચાર્યજીના અનુયાયી દ્વારા માયાવાદ ખીલ વાહો કરતાં શ્રેષ્ઠ છે એવો બોધ જ્યારે કૃષ્ણાદેવને આપવા માંડયો, ત્યારે કૃષ્ણાદેવે તમામ વાદ અને ધર્મના શુણું હોય નક્કી કરવાનો નિશ્ચય કર્યા. આ નિશ્ચયને અનુસરીને તેણે આપા આર્થિકર્તાના વિદ્ધાન આચાર્યો અને પંડિતોને પોતાના દરખારમાં બોલાયા, અને તેઓને ચર્ચા ચલાવી કર્યો. વાદ અને કર્યો. ધર્મ શ્રેષ્ઠ છે એનક્કી કરવાનું કહ્યું. તે ઉપરથી લેગા મળેલા આચાર્યા અને પંડિતો વરચે વાદ થયો. આ વાદ ધર્મા દિવસ સુધી ચાલ્યો, અને શ્રીશાકરાચાર્યજીના અનુયાયીએ ક્રોદ્ધમંદ થવાની અણી ઉપર હતા. આવી અણીની વખતે શ્રીમહવલભાચાર્યજી વિદ્ધાનગર આવી પોહેચ્યા, અને તે સભામાં એમણે ધર્મા આગળ પડતો ભાગ લીધે. એમણે સાણિત

કરી આપણું કે શ્રી શાંકરાચાર્યજીનો માયાવાદ અને ખી-જા વાહો હોથ ચુક્તા છે. વેહ, ઉપનિષદ ગીતા અને અહસ્સૂતોને સર્વ પ્રકારે અનુસરે એવો તો ભાગ્ય અહસ્સ-વાદ અથવા શુદ્ધાદ્રૈતવાદ છે, અને તે સર્વ વાહો કરતાં શૈષ છે, એમ એમણે સંપૂર્ણ રીતે સિદ્ધ કરી આપણું. પ્રતિ-પદ્ધતીઓએ અને ત્યાં મળેલા તમામ પંડિત અને આચાર્યાઓએ એમનો વિજ્ઞય માન્ય કર્યો. પછી તેઓએ એકમતથી કૃષ્ણહેવ રાજને હાથે શ્રી વદ્વલાચાર્યજીને આચાર્ય અને મહાપ્રભુજીની પદવી અપાવી. પછી કૃષ્ણહેવ રાજએ એમનો કનકાલિષેક કર્યો, અને પોતે એમનો સેવક થયો. આ મોટો ખનાવ સન્ ૧૪૬૩ માં ખન્યો. આ વખતે શ્રી વદ્વલાચાર્યજીની ઉત્તર માત્ર ૧૪ વધની હતી. આ વખતથી એ આચાર્યજી મહાપ્રભુજીના નામથી એળખાવા લાગ્યા.

પછી શ્રીમહાચાર્યજી વિદ્યાનગર છોડી યાત્રાને માટે ગયા. દક્ષિણ દેશનાં જે જે સ્થળોમાં વિદ્વાનો રહેતા અને તીર્થનાં સ્થળ હતાં તે ખધાંની એમણે મુલાકાત લીધી. આ સ્થળોમાં એમને શ્રી રામાનુજના અનુયાયી, થોળીઓ, કાપાલિક, શૈવ રામાનંદી, વીર વૈષ્ણવો, માયાવાદીઓ, માહેશ્વરો, વૈરાગીઓ અને ખીજા અનેક માર્ગવાળાઓની સાથે વાદ અને ધર્મ સંખાંધી ચર્ચા થઈ. પછી દક્ષિણ દેશ છોડી શ્રીમહાચાર્યજી પંદ્રપુર થઈ જોકુલ પદ્ધાર્ય. રસ્તામાં જે ધટસરસ્વતીએ સરસ્વતિને વશ કર્યાતું, અને પોતે અદૈાકિક શક્તિવાળો છે એમ કહેવાતું, તે ધટસરસ્વતીની સાથે વાદ થયો. ધટસરસ્વતી થોડીવારમાં હારીને નાસી ગયો.

જોકુળમાં શ્રીમહાચાર્યજીએ પુષ્ટિભક્તિ એટલે નિર્ણય અથવા શુદ્ધ ભક્તિ માર્ગની સ્થાપના કરી. અને પ્રથમ દીક્ષા દામેદરદાસ, પ્રભુદાસ જલેલાટા અને ખીજા વૈષ્ણવોને આપી.

તે પછી આચાર્યજીએ ફરીથી યાત્રા શીર્દુ કરી. પર્યો ચા-લીને દક્ષિણમાં કન્યાકુમારીથી ઉત્તરમાં હિમાતય પર્વત સુધી અને પૂર્વમાં જગત્નાથજીથી પર્શ્વમમાં દારકા સુધી એમણે ત્રણ

વખત યાત્રા કરી, અને આખા આયાવર્તના મુખ્ય વિદ્ધાનોની જુહે જુહે સ્થળે સભાઓ ભરી, તેમજ ખાનગી બેઠકેંમાં, પોતાના અલ્લવાહનું યથાર્થ મંડન કરી તેમની પાસે તે માન્ય કરાંયો, અને પુષ્ટિ લક્ષ્ણ માર્ગનો બોધ આપ્યો. આ કાર્યમાં એમણે અરાદ વર્ષ ખરચ્યાં, દરમિઅાન એ પોતાની અટૂવીસ વર્ષની ઉમ્મરે પરાયા. લગ્ન પછી પણ જે કાયને માટે એમણે અવતાર ધારણ કર્યો હતો તેજ કાર્યં કરવાનું જરી રાખ્યું. લગ્ન થયા પછીજ એમણે ધણ્ણા ખરા મોટા અંથ્યા. થોડે થોડે અંતરે એ ધર્મનો અને અલ્લવાહનો ઉપહેશ કરવા સુસાક્ષરીએ નિકળતા. જ્યારે એ ઘેર રહેતા ત્યારે ગયા ને બનારસની પાસે ચરણાદ્રિ ગાને અદેલ નામનાં નાનાં સુંદર ગામી છે તેમાં સાદાઈથી રહેતા. પોતે ભગવાન તરફ પૂર્ણ લક્ષ્ણ ભાવ સંપત્ત હોવાથી, અને સર્વત્ર સમભાવ રાખનાર હોવાથી, અને લોકેના ઉપર ધણ્ણા દ્યાગુ હોવાથી, એ જ્યાં જતા ત્યાં સર્વને લક્ષ્ણ માર્ગનો અને શુદ્ધારૈત સિદ્ધાન્તનો બોધ આપતા અને સેવા શી રીતે કરી તે શીખવતા.

લક્ષ્ણ ચુક્ત ધણ્ણિજ સાઢી અને કીર્તિવાળી જુંદગી ભોગવી, તથા ધર્મને વિષે જે જે ઈશ્વર સંબંધી પરમતત્વ હતું, તત્ત્વવિદ્યાને વિષે જે ઉત્તમોત્તમ તત્ત્વવિદ્યા હતી, અને લક્ષ્ણ શાસ્ત્રને વિષે જે ક્રીમતી વસ્તુ હતી, એ સધળાનો બોધ કરી, શ્રીમદ્ભાગવાર્યજીએ ખાવન વર્ષની ઉમ્મરે આ ભૂતળને છોડ્યું. દાક્તાર વુદ્ધઃસન સાહેણ કહે છે કે—પોતાના અવતારનો હેતુ પાર પાડી શ્રીમ વિદ્વાભાગ્યજીએ કાર્શીમાં હતુમાન ધાટ આગળ શ્રી ગંગાજીમાં પ્રવેશ કર્યો, અને પાણીમાં નીચા નમતાં પોતે અદ્રશ્ય થઈ ગયા; પાણીના જે લાગમાં એમણે પ્રવેશ કર્યો તે લાગ ઉપર એક ચક્કાંકિત જવાળાનો સ્તંભ હેણ્યો, અને હાજરો મનુષ્યોના હેખતાં એમણે તે જવાળા સ્થંભ દ્વારા વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું, અને પછી આકાશમાં અદૃશ્ય થઈ ગયા.



ભાગ ૨ નો.

શુદ્ધાક્રૈત સિદ્ધાંત અને શ્રીમહૃવલતભાયાર્થનો
ઉપદેશ વગેરે.

અહા અને અહિવાદનું સ્વરૂપ,

(૧) અહનું સ્વરૂપ હોષ વિનાનું છે. તે (અહિ) સર્વ સહશુદ્ધ કુક્તા છે. તે સ્વતંત્ર છે અને પ્રાકૃત શરીર અને તેના ગુણું વગરનું છે, તે પૂર્ણ આનંદ છે. એના હાથ, પગ, મુખ, ઉદ્ધર વગેરે આનંદ માત્ર છે. તે સર્વ ઋયાપક છે અને ૫૩, જીવ અને અંતર્યામી એ ત્રિવિધ લેદ રહ્ણી છે.

(૨) અહિ અનંત મૂર્તિ છે, તે કૂટસ્થ તેમજ ચલાયમાન છે. તે સધળા વિરુદ્ધ ધર્મેના આશ્રયરૂપ છે. તે માત્ર ખુદ્ધિથી જાણ્ણી શકાય એમ નથી.

(૩) જેને ઉપનિષદમાં અહિ કહે છે, સમૃતિએમાં ૫૨. માત્રમા કહે છે, તેને ભાગવતમાં ભગવાન કહે છે.

(૧) નિર્દોષપૂર્ણગુણવિગ્રહ આત્મતંત્રો ।

નિશ્ચેતનાત્મકશરારીરગુણૈશ્રહીનઃ ॥

આનંદમાત્રકરપાદમુખોદરાદિઃ ।

સર્વત્ર ચ ત્રિવિધભેદવિવર્જિતાત્મા ॥

નિખંધ ૧. ૪૪

(૨) અનંતમૂર્તિં તદ્રહ્ષ કૂટસ્થં ચલમેવચ ॥

વિરુદ્ધસર્વધર્માણમાશ્રયં યુક્તયગોચરમ् ॥

નિખંધ ૧. ૩૧

(૩) વેदાંતે ચ સ્મृતૌ બ્રહ્મલિંગં ભાગવતે તથા ।

બ્રહ્મોત્તિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે ॥

ત્રિતયે ત્રિતયંવાચ્યં ક્રમેણૈવ મયાડત્ર હિ ॥

નિખંધ ૧.૬

(૪) અલ સચ્ચિદાનંદૃપ છે. તે સર્વબ્યાપક અને અવ્યય છે. લે સર્વ શક્તિયુક્ત છે, અને સ્વતંત્ર છે. તે સર્વજ્ઞ છે, અને તેના ઉપર (સાત્ત્વિક, રાજ્યસ, તામસ) ગુણોની સત્તા ચાલતી નથી.

(૫) આ જે સધળું હેખાય છે તે ખરેખર આત્માજ છે. તે સુજ્ઞ છે અને સુજ્ઞય છે. વિશ્વાત્મા રક્ષણુ કરે છે અને વિશ્વાત્માનું રક્ષણુ કરાય છે, તે હુરે છે અને તે હુરણુ થાય છે.

(૬) આ બધું આત્મા છે. તેજ પ્રમાણે આ બધું અલ છે. તમામ શ્રુતિઓનો આ અર્થ છે, એમ અહુણુ કરી, સર્વ જળે પોતાની બુદ્ધિ પ્રમાણે (તે) સાધ્ય કરવું. આજ અલવાદ છે. ખીજું બધું મોહરૃપ છે.

(૭) નીચે છાપેલા અને તે ઉપરાંત નિખંધમાંના ખીજ ઘણું. ક્ષેત્રાકે અલનું અને અલવાદનું વિશેપ વણુંન કરે છે.

(૮) સચ્ચિદાનંદહુંતુ બ્રહ્મ બ્યાપકમબ્યયમ् ।

સર્વજ્ઞક્તિ સ્વતંત્રં ચ સર્વજ્ઞં ગુણવર્જિતમ् ॥

નિખંધ ૧ ૬૫

(૯) આત્મૈવ તદિદંસર્વ સુજ્યતે સુજતિ પ્રમુઃ ॥

ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હ્રિયતે હરતીશ્વર: ॥

નિખંધ. ૨. ૧૮૩.

(૧૦) આત્મૈવતદિદં સર્વ બ્રહ્મૈવ તદિદં તથા ।

ઇતિ શ્રુત્યર્થમાદાય સાધ્યં સર્વૈર્યથામતિ ।

અયમૈવ બ્રહ્મવાદ: શિષ્ટ મોહાય કલિપતમ् ॥

નિખંધ. ૨. ૧૮૪.

(૧૧) સજાતીયવિજાતીયસ્વગતદ્વैતવર્જિતમ् ॥

સત્યાદિગુણસાહસ્રેર્યુક્તમૌત્પત્તૈકૈ: સદા ॥

નિ. ૧. ૬૬.

સર્વધારં બદ્ધમાયમાનંદાકારમુત્તમમ् ॥

પ્રાપંચિકપદાર્થાનાં સર્વેષાં તાદ્વિલક્ષણમ् ॥

નિ. ૧. ૬૭.

(૮) જેને અલ, પરમાત્મા અને ભગવાન કહેવામાં આવે છે, તેને શ્રીમદ્વાલ્લભાર્યજી નીચેના હોક્સે આધારે શ્રી હૃષુ કહે છે.

કૃપિભૂવાચક: શબ્દોણશ્રાન્તિવૃત્તિવાચક: ॥
તયોરૈકંય પરંબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે ॥

અર્થ:—કૃપ્ય શાંદ સત્તાવાચક છે. એ આનંદ વાચક છે. એ અન્નેનો લેખો અર્થ પરાયન થાય છે.

જગત्.

(૯) જ્યારે અલ અનેક થવાની દૃશ્યા કરે છે, ત્યારે તેનું સ્વરૂપ જે સત્ત ચિત્ત અને આનંદરૂપ છે, તેમાંથી જેમ દૈવતામાંથી તત્ત્વિયા નિકળે તેમ અનેક સૂક્ષ્મ પદાર્થો નિકળે છે. (વિસ્કુલિઙ્ગાદ્વ).

(૧૦) જે પદાર્થો અજ્ઞના સહંશમાંથી નિકળે છે તે જરૂર પદાર્થો થાય છે, જે અજ્ઞના ચિહ્નશમાંથી નિકળે છે તે જીવ થાય છે, અને જે એના આનંદશમાંથી નિકળે છે તે અંતર્યામી થાય છે. આ સધળા સત્યરૂપ અલમાંથી નિકળે છે, તેથી તે સત્ય છે. તે અસત્ય હોઈ શકે નહિં. એટલા માટે જગત્ અથવા હુનિયા મિથ્યા કે અસત્ય કે એટી નથી.

(૧૧) જીવ પરમાણુ જેવો છે.

(૧૨) ૧-આવિર્લાવ અને ૨-તિરોભાવ એ બંને પરાયનની શક્તિઓ છે. જ્યારે પરાયનની આવિર્લાવ શક્તિની કિયા ચાડો છે, ત્યારે જગત્ અસ્તિત્વમાં આવે છે. જ્યારે પરાયનની તિરોભાવ શક્તિ કિયાવાન થાય છે ત્યારે માત્ર જગતનું રહે છે, અને જગત્ અલમાં લીન થાય છે.

(૧૩) જીવસ્તવારાગ્રમાત્રો હિ. ।

ભક્તિ.

શ્રીમહૃવદ્વલભાગ્યાર્થજી ભક્તિ વિષે નીચે પ્રમાણે બદે છે.

(૧૩) ભગવાનના માહાત્મ્યના જ્ઞાન સહિત, એમને વિષે આ જગત્તના જે જે પદાર્થો ઉપર સ્નેહ હોય છે તે સર્વ કરતાં અધિક અને સુદૃઢ સ્નેહ એને ભક્તિ કહે છે. માત્ર આવા પ્રકારની ભક્તિથીજ મુક્તિ મળે છે, ખીજ ફોંડ સાધનથી મુક્તિ પ્રાપ્ત થતી નથી.

(૧૪) પર્વત આદિને લેદી તેઓથી થતી અડયણે દ્વર કરી લેમ ગંગાજીનો પ્રવાહ સમુદ્રને વિષે અવિચિન્જ ચાલે છે, તેમ વેદ, સમૃતિ આદિમાં કહેલી કિયાઓથી થતી અડયણો દ્વર કરી, સર્વની હૃદયગુહામાં સ્થિતિ કરતા ભગવાનને વિષે મનની અવિચિન્જ જે ગતિ તે ભક્તિ.

ભક્તિના પ્રકાર.

(૧૫) પોતે જે ભક્તિનો બોધ કર્યો અને ખીજ આચાર્યાંએ જે બોધ કર્યો તે વિષે બોલતાં, શ્રીમહૃવદ્વલભાગ્યજી કહે છે કે:-લેદ સાચો છે, એ વાતને આગળ કરીને સગુણુ ભક્તિ ત્રણુ પ્રકારની છે એમ કહેવામાં આવે છે:—

(૧૩) માહાત્મ્યજ્ઞાનપૂર્વસ્તુ સુદ્રઢઃ સર્વતોધિકઃ ॥

સ્નેહો ભક્તિરિતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાડન્યથા ॥

નિષ્ઠ. ૧ ૪૩.

(૧૪) સર્વ ગુહાશયે માયિ ભગવતિ પ્રતિબન્ધરાહિતા અવિચિછ્જા યા મનોગતિ: પર્વતાદિભેદનમપિકૃત્વા યથાગ્નામ્ભ: અમ્બુધૌ ગચ્છતિ તથા લૈકિકવૈદિકપ્રતિબન્ધાન् દૂરીકૃત્ય યા ભગવતિ મનસોગતિ:।।

સુબોધિનિ પृષ્ઠ ૭૪૯.

(૧૫) ભેદ: પરમાર્થ ઇતિ શાસ્ત્રં પુરસ્કૃત્ય ત્રિવિધો ભક્તિ-યોગ ઉક્ત: તેવસાંપ્રતં વિષણુસ્વામ્યનુસારિણ: તત્ત્વવાદિન: રામા-નુજાશ્વેતિ તમોરજ: સત્ત્વૈર્ભિન્ના: અસ્મત્પ્રતિપાદિતશ્રનૈર્ગુણ્ય: ॥

સુબોધિનિ. પृષ્ઠ ૮૩૩.

અમે ને ભક્તિનો પોધ કરીએ છીએ તે નિર્ગુણ અથવા પુષ્ટિભક્તિ છે, શ્રી વિષણુસ્વામીના અનુયાયીએ જે ભક્તિ કરે છે તે તામસ ભક્તિ છે, જે ભક્તિ શ્રી મધ્વાચાર્યના અનુયાયીએ કરે છે તે રાજ્ય છે, અને જે રામાતુજના અનુયાયી કરે છે તે સાંત્વિક છે.

(૧૬) શ્રીમહ્વલ્લાચાર્યાંજુ પુષ્ટિ શખદ લગવાનની કૃપાના અર્થમાં વાપરે છે. જેમ કેટલાક લોકો ભૂલ ભરેલી રીતે ધારે છે, તેમ પુષ્ટિ શખદ સ્થૂલ શરીરના પોષણના અર્થમાં એમણે વાપર્યો નથી. શ્રીમહાચાર્યાંજુ પુષ્ટિ શખદની નાચે પ્રમાણે ડ્યાખ્યા કરે છે:—

શાસ્ત્રો કહે છે કે તેઓમાં કહેલાં સાધનોવડે પ્રાત કરેલાં જ્ઞાન અને ભક્તિથી મુક્તિ મળે છે. એ સાધનોથી પ્રાત કરેલી મુક્તિને મર્યાદા અથવા હુદ કહે છે. પણ કેટલાક જીવ એવા છે કે તેઓ શાસ્ત્રમાં કહેલાં સાધનોનો ઉપરોગ કરી શકે નહિં: તે કારણથી લગવાન પોતાના સ્વરૂપ બળથી આ ગ્રાણીએને પોતાની પ્રાતિ કરી આપે છે. લગવાનના આ કૃત્યને પુષ્ટિ કહે છે.

(૧૭) શ્રીમહાચાર્યાંજુના મત પ્રમાણે ઘ્રણા, વિષણુ અને શિવ એ શ્રીકૃષ્ણ પરથ્રળના ગુણવત્તાર છે. માયા એ પરથ્રળની ઈચ્છા શક્તિ છે. સત્ત્વ, રજ અને તમોગુણ એ માયાની સર્તા છે. એ ગુણુની અસર ઘ્રણા, વિષણુ અને શિવનુના ઉપર થોડી અથવા ધણી થાય છે, પણ એ ગુણોની પરમાત્મા ઉપર કાંઈ અસર થતી નથી, એટલા માટેજ લગવાન નિર્ણયુ કહેવાય છે.

ઘ્રણ સંખ્યા.

(૧૮) ઘ્રણસંખ્યા એટલે લગવાનની સાથેનો સંખ્યા. ભક્તિ માર્ગમાં દાખલ થનારે પ્રથમ કામ એ કરવાનું છે કે

(૧૯) કૃતિસાધ્યં સાધનં જ્ઞાનમક્રિયં શાલેણબોધ્યતે
તાભ્યાં વિહિતાભ્યાં મુક્તિર્મર્યાદા । તદ્રહિતાનામણિ સ્વસ્વરૂપબલેન
સ્વપ્રાપણ પુષ્ટિરિત્યુચ્યતે ॥

જીવ અને ભગવાનની વરણે જે સંખ્યાંધ છે તે યથાર્થ રીતે ઝ-
મજુવો. આ વિષયના સંખ્યાંધમાં જે કિયા કરવામાં આવે છે
તેમાં એક મંત્ર બોલાવવામાં આવે છે, જેનો અર્થ ભગવાનને
વિષે સંપૂર્ણ રીતે આત્મનિવેદન, અથવા સંપૂર્ણ રીતે ભગવાનને
શરણે થલું એ છે. ગીતાજીના અરાડમા અધ્યાયના છાસઠમા
શ્લોકના સર્વધર્માન્દ પરિત્યજ્ય મામેકં શરણ વ્રજ । સર્વ ધર્મનો
પરિત્યાગ કરી મારે એકલાનેજ શરણે થ એ વાક્ય ઉપર,
ઉપરનો મંત્ર આધાર રાખે છે.

x x x x x

આ જગતને વિષે જે વસ્તુઓને જીવ પોતાની કહે છે તે
સધળી વસ્તુઓ, માલ, મિલકત વગેરે તમામ ભગવાનનેજ
(કોઈ શુરૂ કે દ્વારાને નહિ) અર્પણ કરવાની છે. આ કિયાનેજ
ખીજુ રીતે આત્મનિવેદન અથવા શરણ કહે છે. આ આત્મનિવે-
દન અથવા શરણને નિય યાહ કરલું અથવા અનુભવલું જોઈએ.

ભગવાનની સેવા.

(૨૦) જ્યારે હેશ, કાળી, દ્રોય, મંત્ર, કર્તા! અને કર્મ એ
છ પદાર્થો શુદ્ધ હોય ત્યારેજ યજ અને ખીજુ કિયાઓ વગેરે
કૃળીભૂત થદ શકે છે. આ કળિયુગમાં એ છ પદાર્થો શુદ્ધ મળી
શકતા નથી તેથી કળિયુગમાં માત્ર લક્ષ્મિજ સાધ્ય અને કૃત
આપનારી છે.

લક્ષ્મિભાઈ ભગવાનની સેવાની અગત્ય છે. સેવા એટલે
ભગવાનમાં મનતુ' પરોવાવુ'. સેવા ત્રણુ પ્રકારની છે. (૧)
તતુજ એટલે શરીરથી થતી. (૨) વિતજ એટલે પૈસાથી
થતી. (૩) માનસી એટલે મનથી થતી. એ ત્રણુ પ્રકારની
સેવામાંથી માનસી સેવા ઉત્તમ છે. માનસી સાપરામતા । તે
તતુજ અને વિતજ સેવા કર્યાથી સિદ્ધ યાય છે.

નોટ—ઉપર કહેલા સર્વ ધર્માન્દ વાળા શ્લોક ઉપર શરણ મંત્ર
આધાર રાખે છે. અને યત્કરોષિ (ગીતા અધ્યાય ૮ના શ્લોક ૨૭ મા
ઉપર આત્મનિવેદનનો મંત્ર આધાર રાખે છે.

(૨૨) શ્રવણુ, કીર્તન અને સમરણુથી લક્ષિત ઉત્પન્ન થાય છે.

(૨૩) જ્ઞાનસહિત શુદ્ધભાવથી, અને વસ્તુતુ તત્ત્વ જાણીને, બુદ્ધિપૂર્વક ભગવાનનાં નામ લેવાં જોઈએ. જેમ જળના પુરથી કચરાનો ટગલો ઘસડાઈ જાય છે, તેમ ભગવાનની કીર્તિ સાંભળવાથી અને તેનું ગાન કરવાથી પાપોનો નાશ થાય છે. ભગવાનની કીર્તિનું પુર કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે, અને હૃદયમાં રહેલાં પાપોને વલોવી નાંખી મુખદ્વારા બહાર કાઢી નાંખે છે. આ પ્રમાણેનો માવરો થોડા વખત સુધી કરવામાં આવે તો અંતઃકરણ નિર્મણ થાય છે.

(૨૪) ભગવદ્વાચક શાખાની શક્તિનો અને તાત્પર્યનો જીજાને બોધ કરવો અથવા પોતે તે તાત્પર્યને જાણવું તેનું નામ કીર્તન.

(૨૫) જે મનમાં હુનિયાદારીના વિષયોના વિચાર હોય છે અથવા જે હેઠ વિષયાકાન્ત હોય છે તેમાં શ્રીહરિનો આવેશ આવી શકતો નથી.

શ્રીમદ્ભાગ્વતાર્થજીના તત્ત્વવિદ્યા વગેરે સંબંધિ રચેલા ગ્રંથો.

(૧) તત્ત્વદીપ અથવા નિબંધ. આ અન્થનાં ત્રણુ પ્રકરણુ છે. તેના પહેલા પ્રકરણનું નામ શાસ્ત્રાર્થ એટલે ગીતાનો અર્થ છે. તેમાં ગીતાનું તાત્પર્ય છે. ગીતાનો અદ્યાસ કરનારે આ પ્રકરણુ અવશ્ય વાંચવું જોઈએ. બીજું પ્રકરણુ સર્વનિર્ણય

(૨૩) જ્ઞાનપૂર્વક શુદ્ધભાવેન વસ્તુતત્ત્વેજાત એવ તદ્બુદ્ધયા ઉચ્ચારિતાનિ । પુણે શ્રવણકીર્તનેઅસ્ય અનેન પાપં જલપૂરેણેવ નાદ્યતે । શ્રવણે પ્રવિશતિ કથાપુરો હૃદયે તત: સર્વમેવ દોષમાલોદ્ધ મુખતોનિઃસરતિ એવં કિયત્કાલપર્યાવૃત્યા સર્વથૈવ શુદ્ધો ભવતિ ॥

સુબોધિનિ.

(૨૪) શક્તિતાત્પર્યબોધનકીર્તનમ् ॥

સુબોધિનિ.

(૨૫) બિષયાવિષ્ટચિત્તાનાં વિષ્ણવાવેશસ્તુદૂરત ઇતિ ।

વિષયાક્રાન્તદેહાનાં નાડવેશ: સર્વથા હરે: ॥

નામતુ' છે. આર્થિવર્તના ચાલતા સર્વ ધર્મો અને વાહો ઉપર શ્રીમહાર્યાર્થજુનો શો અલિપ્રાય છે, તે આ પ્રકરણુમાં જણુવે. દો છે. આ પ્રકરણુમાં તત્ત્વવિદ્યાના તમામ અંથોની સમીક્ષા છે, એમ કહીએ તો ચાઢે. ત્રીજું પ્રકરણ ભાગવતાર્થ કહેવાય છે. તેમાં શ્રીમહ્ય ભાગવતના શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અદ્યાર્થતું નિરૂપણ કરેલું છે. બાકીના ત્રણ અર્થ વાક્યાર્થ, શાખાર્થ અને અક્ષરાર્થ શ્રીસુષેધિનીજુમાં આવ્યા છે. આ નિ. ખંડ ઉપર શ્રીમહાર્યાર્થજુએ પ્રકાશ નામની ટીકા પણ કરેલી છે.

(૨) અણુભાઈ. પ્રહાસ્ત્ર ઉપર એ એક સમર્થ વિદ્ધિતા ભરેલી ટીકા છે. આ અણુભાઈનો અંથ અંઠી અદ્યાર્થ સુધી શ્રીમહાર્યાર્થજુનો લખેલો છે. બાકીનો ભાગ એમના પુત્ર શ્રીવીકુલનાથજુનો લખેલો છે.

(૩) પૂર્વ મીમાંસા ભાઈ, એ નૈમિનિ સૂત્ર ઉપર આ. ર્યાર્થશ્રીની ટીકા છે, આ પુસ્તક એમને ઉપલખ થયું નથી.

(૪) સુષેધિની આ શ્રીમહ્ય ભાગવતના પહેલા ત્રણ સ્કંધ અને દશમા સ્કંધ ઉપર શ્રીમહાર્યાર્થજુની ટીકાનું પુસ્તક છે. આ સર્વોપરિ અન્થ છે. સર્વ શક્તિમાન ભગવાનને વિષે અપૂર્વ સ્નેહ સંખાર્થી વિદ્યાનો અંથ શ્રીમહ્ય ભાગવત છે, એ વાત આ ટીકાથી નિઃસંશય રીતે સિદ્ધ થાય છે.

(૫) નાના અંથોમાં સિદ્ધાંત મુક્તાવલી, બાલષેધ, કૃ. ષણ્ણાશ્રય, સંન્યાસનિર્ણય વગેરે પ્રસિદ્ધ છે, નંબર ઉ જ સિવાયનાં ઉપરનાં તમામ પુસ્તકો સંકૃતમાં પ્રસિદ્ધ થયાં છે.

શ્રીમહાર્યાર્થજુએ ચોરાશી અંથો લખ્યાનું કહેવામાં આવે છે. તેમાંના કેટલાએક મળી શકતા નથી. અમેએ શ્રીવિકલ્પ અર્થિત નામતુ' પુસ્તક ગુજરાતી લાખામાં છપાયું છે, તેમાં એમનાં પુસ્તકેની સંપૂર્ણ ટીપ આપી છે.



ભાગ તુ નો.

આ નિઅંધ લખનારની ટીકા.

(૧) ધર્મના ધર્ણું કરી એ ભાગ પાડવામાં આવે છે, (૧) તે કે જેમાં કાંઈ કર્મ કરવાનું હોય છે, અને (૨) જેમાં કાંઈ કર્મ કરવાનું હોતું નથી. પહેલાને પ્રવૃત્તિ માર્ગ કહે છે, અને બીજાને નિવૃત્તિ માર્ગ કહે છે, પહેલામાં યજ્ઞ યાગ વગેરે ક્રિયાઓ કરવાની હોય છે, આ ક્રિયાઓ કરવાથી પાપનો નાશ થતો નથી, પણ તેથી સંપત્તિ, પુત્ર વગેરે અને છેવટ સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે. પણ આ સધળાં ફળ ક્ષણિક છે. બીજા એટલે નિવૃત્તિ માર્ગથી પાપનો નાશ થાય છે, અને મતુષ્યને પોતાનો આત્મા જે સર્વ શક્તિમાન ભગવાનના ભૂય સ્વરૂપ આગળ એક આળું જેવો હેખાય છે, તે જેવાને શક્તિવાન કરે છે. સર્વ શક્તિમાન ભગવાનને પ્રાપ્ત થવા માટે, એમને ચહાવાની, એમના ઉપર સ્નેહ રાખવાની, જરૂર છે, અર્થાતું જે ભગવત્પ્રાપ્તિરૂપ ફળની છદ્ધા રાખતો હોય તેણે શુદ્ધ પ્રેમને એટલે ભક્તિને માર્ગે પ્રયાણું કરવાની અગ્રત્ય છે.

(૨) જે જ્ઞાન માર્ગે જાય છે તેને અભિમાન અથવા અહુંકાર ઉપનન થવાનો સંભવ છે. શ્રીમહાર્યાર્થજી કહે છે કે નિવૃત્તિ માર્ગે પ્રયાણું કરનારને પોતાનેજી ઉપદ્રવ કરવાની જરૂર રહે છે. પ્રવૃત્તિ માર્ગમાં જો દ્રોયમય કે ક્રિયામય પ્રયોગ કરવામાં આવે, તો તેમાં બીજાને ઉપદ્રવ થવાનો સંભવ છે. એ કારણથી આ બંને માર્ગના સંખ્યામાં ભગવાનને અપરિતોષ રહે છે.

(૨) દ્વાર્યમયશ્રેત્પરોપદ્રવકારી ક્રિયામયશ્રેદાત્મોપદ્રવકારી જ્ઞાનમયશ્રેત્પરોપદ્રવકારી તથાયમેવાપરિતોષ:તપસિ.

(૩) ભગવાન પ્રાણી માત્રના આત્મા છે, જે ધર્મમાં પ્રાણી માત્રને વિષે પ્રેમ હોય તેજ ધર્મ ભગવાનને ધણોજ સંતોષ આપે છે. એ ઉપરથી અતુમાન થાય છે કે. જે ધર્મમાં સર્વના ઉપર હ્યા, અને પ્રેમ રાખવાની આજી હોય, જે ધર્મ પોતાને કે ખીજને કોઈ પણ રીતે ઉપદ્રવ કરે એવો ન હોય, અને જેમાં ભગવાનને વિષે અપૂર્વ પ્રેમ હોય, તેજ ધર્મ ઉંચામાં ઉંચો અને સર્વોપરિ છે. આ ધર્મ શ્રીમહાર્થાર્થજીએ એધ કરેલા પુણિ અથવા નિર્ગુણ અકિતમાર્ગ સિવાય ખીજો એકે નથી.

(૪) શ્રીમહદ્વલલાર્થજીએ જે અકિતનો એધ કર્યો છે તે અકિતમાં ભગવાનનું માહાત્મ્ય જાણીને એમના ઉપર અધિક સ્નેહ રાખવો એજ તત્ત્વ છે. આ ધર્મમાં સંપૂર્ણ રીતે સ્વાર્થના ત્યાગની અને આત્મનિવેદનની જરૂર છે.

(૫) શ્રીમહદ્વલલાર્થજીએ જે અકિતનો એધ કર્યો છે તે જ્ઞાન અને કર્મ કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાનથી મન પવિત્ર થાય છે, અને તેથી ખરા ઐટાની પરીક્ષા થઇ શકે છે. જ્ઞાનની મહદ્દ્યથી મનુષ્ય સંસાર રૂપી સાગર તરી શકે છે, પણ અકિત ન હોય તો, જે ભગવાન સંસાર સાગરના કિનારથી ધણે ફૂર છે તેમની ગ્રાત્યિ થઇ શકતી નથી.

કર્મથી અંતઃકરણ નિર્મળ થાય, અને સ્વર્ગની પણ પ્રાત્યિ થઇ શકે, પણ સ્વર્ગની જુંદગી આ ભૂતળ ઉપરની જુંદગીના જેવીજ નાશવાન છે. જ્ઞાન માર્ગે પ્રયાણ કરવું મુશ્કેલ છે, અને તે પ્રમાણે વર્તતું કેટ સાધ્ય છે. કર્મમાર્ગ થોડે અથવા ધણા અંશે સ્વાર્થથી રંગાયેલો છે, અને ખીજને ઉપદ્રવકારક છે. આ ખંને માર્ગમાં દરેક માણુસને પોતાનાજ બળ ઉપર આધાર રાખવાની જરૂર પડે છે. અકિતને વિષે આત્મનિવેદનને લીધે સર્વ શકિતવાન ભગવાનના બળ ઉપર આધાર રાખવાનો અકિતને અધિ-

(૩) સર્વોંજીવા યસ્માદિતિ વા સર્વોંજીવાત્મરૂપો વા અતઃ સર્વોપકારિણી ધર્મેતોष ઉચ્ચિત:

કાર પ્રાપ્ત થાય છે. ભગવાન કૃપાયુક્ત હોવાથી પોતાના લક્ષ્ણનું તેના પ્રયાણું માર્ગમાં રક્ષણું કરે છે, એટલા માટે લક્ષ્ણને ખાડામાં પડવાની લીતિ નથી. લક્ષ્ણ માર્ગના પ્રારંભમાં આનંદ રહેલો છે, તેમજ અંતમાં પણ મુક્તિ અને બેહુદ આનંદ છે. એ પ્રમાણે લક્ષ્ણ એ જાન અને કર્મ કરતાં શ્રેષ્ઠ છે.

(૬) શ્રીમહાવલ્લભાચાર્યજી એ જે તત્ત્વ વિદ્યા અને ધર્મનો બોધ કર્યો. તે કોઈ અસુક જત અથવા ભતવાળાને માટે નહોતો, પણ તે આખી હુનિયાંને માટે હતો. એમના શુદ્ધાદૈત ભતને શાસ્ત્ર તથા અંતઃકુરણું તરફથી પુણિ અને સંમતિ મળે છે અને એમણે પ્રેમ રૂપ જે ધર્મ બતાવ્યો છે તેનો કુંદરતજ બોધ કરે છે. શ્રીમહાચાર્યજી શાસ્ત્રીય કિયાયો અને નિયમોને લક્ષ્ણને વિષે ધ્યાન વજન આપતા નથી. એમનો બોધ એવો છે કે લક્ષ્ણના લૈલિક અને અલૈલિક ધર્મ સંધ્યા સર્વ કર્યોમાં પ્રેમ, વિશ્વાપિ પ્રેમજ, નિયામક હોવો જોઈએ. હુનિયાંદારી ધર્યાઓના ગંધ કે રૂપર્શી વિનાના પ્રેમ, સર્વોપરિ પ્રેમ, ઉપરજ એમણે વિશે કરીને લાર મુક્યો છે.

(૭) આચરણુની બાખતમાં જે સાદ્ધ નિયમ એમણે બતાવ્યા છે તે નીચેના શ્લોકમાં આવી જાય છે:—

સ્વધર્માચરણ શક્તથા વિધર્માંશ નિર્વર્તનમ् ॥
ઇન્દ્રિયાશ્વરિનિગ્રાહ સર્વથા ન ત્યજેત્ત્રયમ् ॥

અર્થ—દરેક માણુસે પોતાના વણુશ્રમમાં કહેલા ધર્મ શક્તિ પ્રમાણે પાળવા અને વિધર્મથી ફૂર રહેલું, અને ઇદ્રિયેના અથવે દોકવા, આ ત્રણ વાનાં કઢી તજવાં નહિ.

(૮) શ્રીમહાચાર્યજીએ સર્વને આ સાદ્ધ નિયમો પ્રમાણે વર્તવાને લક્ષામણુ કરી છે. તેની સાથે શ્રવણ; કીર્તન અને સમરણદ્વારા ભગવાનનું માહાત્મ્ય જાણવું, અને એ વિશ્વાત્મા હોવાથી એમના ઉપર અત્યંત સનેહ રાખવો એમ કહેલું છે.

(૮) જે આ હુનિયામાં કોઈ કાળે એકજ વિશ્વંયાપી ખર્મ થવાનો સંભવ હોય, તો તે શ્રીમહાચાર્યજીએ ખતાવેલી રેખાઓ પ્રમાણેજ થવાનો સંભવ છે.

(૯) પોતાનો બોધ આપા વિશ્વને અનુકૂળ આવે એવો હોવાથી આર્થિજનો અને મુસલમાનોને એ બોધને માટે ધાર્યુ માન હતું. *

(૧૦) શ્રીમહાચાર્યજનો બોધ કેવા પ્રકારનો છે એ વાતના અજ્ઞાનને લીધે કેટલાક લોક ઐટી રીતે એમ ધારે છે કે પુષ્ટિ એટલે શરીરને પુષ્ટ કરવું તે. આ ધારવું ફેવળ ભૂલ કરેલું છે. શ્રીમહાચાર્યજીએ પુષ્ટિ શખફ સર્વ શક્તિવાન ભગવાનની કૃપા કે અનુગ્રહના પારિલાખિક અર્થમાં વાપર્યો છે. સ્વાર્થ રહિતપણ્યાથી ભગવાનના ઉપર સ્વનેહ રાખવાથી ભગવાનની કૃપા સંપાદન કરી શકાય છે, અને આવી કૃપાને પુષ્ટિ કરે છે. જે માર્ગથી આવી કૃપા મેળવી શકાય તે માર્ગને પુષ્ટિ ભક્તિ માર્ગ કરે છે. ઈપિ. કયુરીઝનો (ખાંડ પીઠને મેળજ કરવાથીજ શ્રેય સાથી શકાય છે, એવો બોધ આપનાર કેટલાએક શ્રીક તત્ત્વવેત્તાએ અને તેમના અનુયાયોઝો) ને પ્રમાણેની જુંદગી ગાળતા તે પ્રમાણેની જુંદગી ગાળવાનો બોધ શ્રીમહ્ વહૂલાચાર્યજીએ પુષ્ટિ માર્ગને વિષે આપ્યો છે એમ માત્ર પુષ્ટિ શખફ ઉપરથી ડેકટર વુદ્ધલસન અને હુંટરની માર્ક્ઝ ભૂલ લરેલી રીતે ધારવું એ ધાર્યું

નોંધ—કેટલાક મુસલમાનો શ્રીમહાચાર્યજના અનુયાયી થયા હતા. દિંહીના બાદશાહ સિકંદર લોદીને શ્રીમહાચાર્યજને માટે એટલું બધું માન હતું કે તેણે શ્રીમહાચાર્યજની છથી ઉતારવાને માટે પોતાના પ્રખ્યાત ચિત્રકાર હોનહારને એમની પાસે મોકદ્યો હતો. તેણે લીધેલી છથી હાલ સુધી કુશનગઢના રાજને ત્યાં છે. હુમાયું અને અકૃષ્ણ બન્ને શ્રીમહાચાર્યજને માટે ધાર્યું માન ધરાવતા હતા. મધ્યકાલના ઈતિહાસમાં શાખ કરવામાં આવશે તો શ્રીમહાચાર્યજના કાંમની મહતા અને તેની લાભ-કારક અસરની ખાર્તી થશે.

જોર વ્યાજખી છે, કારણ કે એમણે જે બોધ આપેલો છે તેમાં વિષયનો ગંધ નથી, એટલું જ નહિં પણ એમણે અપ્રતિમ રીતે વિષયનો નિષેધ કર્યો છે. *

(૧૧) ઈન્દ્રિયોથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ઈશ્વરને પહેંચી શકતું નથી. ભગવાન માત્ર અંતઃકરણથી પહેંચી શકાય એવા છે.

શ્રીમહાચાર્યનું જીવન સર્વંશે લગ્નવદીય અને લગ્નવન્મય હતું, તે કારણથી એ ભગવાનને ઓળખવાને અને એમના માર્ગો અને લીલાઓને જણવાને અને સમજવાને બીજા બધા કરતાં બધારે ચોણ્ય હતા. આ વાત શ્રીમહ્ ભાગવતના પહેલા ત્રણ સ્કંધ અને દુશમ સ્કંધ ઉપરની એમની શ્રીસુષ્ટોધિની નામની ટીકાથી પુરવાર થાય છે.

અવતાર એટલે શું ? અવતારને મૂળરૂપ સાથે ફેવા પ્રકારનો સંબંધ હોય છે ? ભગવાનની લીલાઓનો હેતુ અને ઉદ્દેશ શા છે ? અને તેઓનો પારમાર્થિક કે અલોકિક ઉપયોગ શો છે ? આ સધળી વાતોનો યથાર્થ ખુલાસે કરનાર તત્ત્વવેત્તાઓમાં માત્ર શ્રીમહાચાર્યજી છે એમ અમે ધારીએ છીએ.

ઇશ્વરોહિ હીનકર્મ ન કરોતિ—ઇશ્વર કદી હીન કર્મ કરતા નથી, આ વાક્યથી શરૂ કરી, શ્રીકૃષ્ણની લીલાઓ જે હજુ સુધી ધરણા પંડિતોને એક કોયડા રૂપ લાસે છે, તે શ્રીમહાચાર્યજી સુંદર રીતે સમજાવે છે.

(૧૨) કોઈ અતકર્ય દૈવયોગને લીધે શ્રીમહ્ વદ્વલાચાર્ય-પંચ શ્લોકીમાં શ્રીમહાચાર્યજી ફંઝે છે કે—

(૧૦) ગૃહં સર્વાત્મનાત્યાજયં તત્ત્વેસ્ત્રયનું ન શક્યતે ॥

કૃષ્ણાર્થ તત્ત્વયુંજાતિ કૃષ્ણોऽનર્થસ્ય મૌચકઃ ॥

અર્થ—ધર જે સર્વ ધૂંછાએ અને વિષયોના મધ્યથિંદુરૂપ છે તેનો સર્વ પ્રગારે ત્યાગ કરવો, જો તેમ ન બને તો તેને શ્રીકૃષ્ણ ભગવાનના અર્થમાં જોડનું, કેમકે એ ભગવાનજ મનુષ્યને સર્વ અનર્થમાંથી મુક્તા કરે છે.

જુની તત્ત્વવિદ્યા અને એમના બોધ વિષે ગેર સમજ ચલાવવામાં આવી છે. આ કારણથી બુદ્ધિશાળી વર્ગ એવો આડે માર્ગે હોરાઈ ગયો છે કે, કોઈ એમના અંથો વાંચતું નથી, અને એમણે પ્રતિપાદન કરેલા શુદ્ધાક્રૈત મતને અને સ્થાપન કરેલા ધર્મ માર્ગને, સમજવાની કોઈ ફરકાર રાખતું નથી. આવી ગેર સમજને લીધે મિસિસ એનીથીસન્ટ જેવા અંથકારો અને ભીજાઓએ પણ ભૂલ કરી છે. “ એસોટેરિક ડિફિચિયાનિટી ” ના ચૈદમા પ્રકરણમાં પૃષ્ઠ ઉદ્દે માં મીસિસ એનીથીસન્ટ શ્રીમહૂ વદ્વાભા ચાર્યને “ અત્યંત અભાષુ ” કહે છે. ડૉક્ટર એચ. એચ. વુર્દિનન, જે લગભગ ચાલીસ વર્ષ સુધી શ્રીમહૂ વદ્વાભાચાર્યજીના અનુયાયીઓની મધ્યે રહ્યા હતા, તે પણ એમના અનુયાયીઓને રૂદ્રસંપ્રદાયી કહે છે. (જુઓ હીંક રીલીજીઅન્સ સને ૧૬૦૧ ની કલકત્તા એડીશન પાનુ ૭૬.)

(૧૩) આ અંથકારો અને એમના જેવા મેસર્સ માર્સ્ડન, ખાર્થ, અને ભીજ ધણા અંથકારોને કોઈ સ્વાભાવિક રીતે પૂછી શકે કે તમોએ શ્રીમદ્દાચાર્યજીના નિષાંધ, અણુભાષ્ય, સુષ્ઠોધિની, અને ભીજ અંથો વાંચી જેયા છે ? આ અંથકારોના અજ્ઞાનને માટે વૈષ્ણવ વર્ગ તેમનો હોષ કાઢતો નથી. આવા પ્રકારતું અજ્ઞાન એ કલિયુગનું માહાત્મ્ય છે એમ જાણું તેઓ સંતોષ માને છે, અને કહે છે કે કલિયુગમાં તો જે તત્ત્વવિદ્યા અને ધર્મ સુદૃઢ અને હુમલો ન થઈ શકે એવાં હોય તેઓને તો વિસમૃતિનેજ તાએ કરવામાં આવે.

(૧૪) શુદ્ધાક્રૈત સિદ્ધાન્ત સ્થાપન કરનાર અને પુષ્ટ જીક્રિતનો બોધ કરનાર શ્રીમહૂ વદ્વાભાચાર્યજીને ૧૮ મી સદીએ જે ગેર છન્સાકુ આપ્યો છે, તેનો ૨૦ મી સદી ચેણ્ય અને સંતોષકારક બહલો, એમના સિદ્ધાન્ત અને બોધને ફરીથી જગૃત કરીને, આપશો.

(૧૫) શ્રીમદ્દાચાર્યજી પેતાના પત્રાબલંબન નામના અંથમાં કહે છે કે વિદ્વાનેજ સન્માર્ગના રક્ષકું છે,

स्वाधिकारानुसारेण मार्गलोधा फलायहि ॥
 अधुना स्वाधिकारास्तु सर्वं एव गता कलौ ॥
 कृष्णम्भ्रेत् सेव्यते भक्तया कलिस्तस्य फलायहि ॥
 नीर्बंध. १-१८.

अर्थ—पेताना अधिकारानुसार ग्रन्थ प्रकाशना भार्गी दूष
 आपनार थाय छे. परंतु आ कलियुगमां सर्वं अधिकार जता रह्या
 छे, तेथी करीने जे श्री कृष्णुनी सेवा करवामां आवे तो कलियुग
 निश्चय दूषीभूत थाय छे.

समाप्त.

ओकृष्ण अवन
 नडियाद.
 ता. १४-३-०८ } }
 लक्ष्मुलाई प्राणवक्ष्मलदास पारेख.

